

હું માતુભાષી હું ગુજરાતી

યગવંદના

Yugvandna Weekly

સાપ્તાહિક

વર્ષ : ૨૪ * અંક : ૨૦ * મુંબઈ * તારીખ : ૬ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી - ૨૦૧૮ * Printed Every Wednesday - Posting Day Every Friday

ડિસ્ટ્રિબ્યુઝલેક ૨૦૧૮ સ્માર્ટ વિતરણ માટે પથદર્શક ટેકનોલોજી, નાવીન્યપૂર્ણ નિવારણો અને અત્યાધુનિક ટેકનોલોજી

મુંબઈ : ફેબ્રુઆરી, ૨૦૧૮ : યુટિલિટી, કન્યામર, ઈલેક્ટ્રિકલ પ્રથમ આવૃત્તિ અને ઈન્ટેક્સ ઇન્ડિયન ઈલેક્ટ્રિકલ ઓફરેશનલ ટેકનોલોજી (ઓટી) ૨૦૧૮ની ટેકનિકલ કોન્ફરન્સનું છીલેક્ટ્રોનિક્સ મેન્યુસ્ટ્રીચર્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી પણ આયોજન કરી રહી છે. એસોસિયેશન ડિસ્ટ્રિબ્યુઝલેક. (આઈટી)ને એક્સમાન મંચ પર ૨૦૧૮ની તેની ત્રીજી આવૃત્તિનું લાવશે. આ જ રીતે ડિસ્ટ્રિબ્યુઝલેક. આયોજન કર્યું હતું. આ પ્રદર્શન આઈઈએમએ બિલ્ડઈલેકની સાથે આર સિલાગ, ભારત

સરકારના એમાસએમાયારીના પર લાવવા માટે ડિસ્ટ્રિબ્યુઝલેક. જોઈન્ટ સેકેટરી સુધીર ગર્ગ, ૨૦૧૮નું આયોજન નિયોજન મહારાષ્ટ્ર સરકારના ઊર્જા વિભાગના કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ શ્રી અરવિંદ સિંહ, એમાસએઈડીએમએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજીવ કુમારને દસ્તે કરવામાં આવ્યું હતું.

લોડ અને વિતરીત નિર્મિતીમાં વૃદ્ધિ વિતરણના નેટવર્ક માટે નવા પડકરો લાવે છે. આ પડકરોમાંથી બહાર આવવા યુટિલિટી પુરવઠાની ગુણવત્તા સુધારવા અને વિશ્વસનીયતા વધારવા અને નુકસાન ઓછું કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીઓ કામે, વગાવી રહી છે. આ પડકરોમાંથી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ અને ડિજિટલ નેટવર્ક ટેકનોલોજીઓ એક્ઝિક્યુશન સાથે જ બહાર આવી શકાય છે. આ પાર્શ્વભૂમાં બધા હિસ્સાધારકોને સશક્ત બનાવવા માટે યુટિલિટી, કન્યામર, ઈલેક્ટ્રિકલ ઓપરેશનલ ટેકનોલોજી (ઓટી) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)ને એક મંચ

Gayour Chopdar
Cell : 9892814544



GUTS
CONSTRUCTION CO.

Specialist in :
New Constructions • Interior
Water Proofing • PCM

Bldg. No. # M-2, Flat No. #308, 3rd Floor, Daulat Nagar, Santacruz (W), Mumbai - 400 054.

Parle Murugan


Authorised Dealer

duroflex

duroflex
mattresses

Sleep 52% Cooler.

Duroflex Heat Absorption Technology™, a NASA Certified Space Technology that regulates your body temperature throughout the night, making the mattress 52% cooler than your regular mattress for a sweat-free sleep.



Certified by
Orthopaedists.



duroflex
mattresses

Shop No. 2,3,4, Shyamkamal 'D', Agrawal Market,
Opp. Parle International Hotel, Vile Parle (E), Mumbai 57

Tel.: 022 2617 8311

MONDAY
CLOSED

વયસ્કને નિઃશુલ્ક ટીફીન અને આદિવાસીઓને વિવિધ સહાયના સાતત્ય સાથે શ્રી નિમેષ તત્ત્વા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમા સેવા વર્ષમાં પ્રવેશ

જરૂરતમંદ વડીલોને આધાર બનવા આજથી છ વર્ષ પહેલાં ૨૭ નિઃશુલ્ક ટીફીન સેવા સાથે ૨૬ જાન્યુઆરી ૨૦૧૭માં શ્રી નિમેષ તત્ત્વા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાના શ્રીગણેશ થયા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ સેવાના સાતમા વર્ષના પદાર્પણ પ્રસંગે પ્રતિકાત્મક કેક કર્ટીંગના કાર્યક્રમમાં જસરાજ દાદા મંડળના ઉપપ્રમુખો શ્રી અર્જુણભાઈ ભિડિ, શ્રી હીરાલાલભાઈ મુગ, શ્રી દેવેન્દ્રભાઈ અનમ તેમજ શ્રી રમેશભાઈ ગણાત્રા અને બંને સંસ્થા વચ્ચે સેતૂરૂપ શ્રી લાલજી સર, દમારા મુલુંડના શ્રી બીપીન પંચાલ સાથે ટ્રસ્ટના શ્રીમતી દમયંતીબેન તત્ત્વા, શ્રી પ્રદીપભાઈ તત્ત્વા, અશ્વિનભાઈ પોપટલ, શ્રી અશ્વિનભાઈ કટારિયા, શ્રી કેલાશભાઈ ભિડિ, જ્યોતિબેન ભિડિ, આરતીબેન કટારિયા, ધારા ગાલા, ધર્મિકા કારિયા શામેલ થયા હતા. શરૂઆતમાં રાણ્ણગીત ગાવામાં

આવ્યું હતું. જસરાજ દાદા મંડળ દ્વારા શ્રી હીરાલાલભાઈ અને કેવલ ફાઉન્ડેશન દ્વારા શ્રી અર્જુણભાઈના દુસ્તે ટ્રસ્ટને અનુદાન આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટી શ્રીમતી દમયંતીબેન તત્ત્વાએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની આછી જલક આપી હતી. અત્યારે જરૂરતમંદ સીનીધર સીટીજનોને નાતજીતના ભેટભાવ વગર ૧૩૫ ફી ટીફીન આપવામાં આવી રહ્યા છે. મુલુંડ-ઝીડીપાડા વિસ્તારના ૧૫૦ આદિવાસી પરિવારોને દર મહિને અનાજ વિતરણ કરવામાં આવે છે. કોપરાફેરણા, ઉરણા, કર્જત વગેરેને પણ સેવાના વ્યાપમાં આવરી લેવાયા છે. દહાણુ આદિવાસી વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ, ગામના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અહીં સ્વાવલંબી જીવન માટે વ્યવસાયોની તકો ઊભી કરવામાં આવી છે.

સેવાઓ તેમજ વિતરણ ઓટોમેશન અને કંદ્રોલ સિસ્ટમ્સ, ઉર્જા કાર્યક્રમતા, માગણીને પ્રતિસાદ, ઓડવાન્સ્ડ મીટરિંગ, કોમ્પ્યુનિકેશન્સ ટેકનોલોજીઝ, સાઈબર સિક્યુરિટી, ઈલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી વગેરેમાં નવા યુગની ટેકનોલોજીઓ પ્રદર્શિત કરતાં વીજ વિતરણ પરનું ભારતનું એકમાત્ર પ્રદર્શન છે. આ પ્રદર્શન નવાં અને નાવીન્યપૂર્ણ પ્રોડક્ટ અને સેવાઓનાં નિવારણો ખોત કરવા, નવા પ્રવાહો, નેટવર્ક સાથે સંપર્કમાં રહેવા અને વેપાર કરવા માટે ઉપયોગી મંચ પુરું પાછે.

બિલ્ડઇલેક ૨૦૧૮- બિલ્ડઇલેકની આ પ્રથમ આવૃત્તિ મુખ્ય પુટિલાઈઝેશન કેન્દ્રો બનવાવા માટે ગ્રાહકોના દ્વારા સીધા ઓટી અને આઈટીનો મેળાવડો પ્રદર્શિત કરવાનું નિયોજન ધરાવે છે, જેમાં ઈમારતો, ઔદ્યોગિક, ક્રમશિયલ અને નિવાસી વધુ કાર્યક્રમ


અને સુરક્ષિત બનાવવા પર ભાર. ઈન્ટલેક્ટ ૨૦૧૮ - કોન્ફરન્સની થીમ ટુર્ફસ સ્માર્ટ, રિલાયેબલ, ઓફિશિયન્સ અને સેફ ઈલેક્ટ્રિસિટી છે. આ કોન્ફરન્સ સ્માર્ટ પાવરમાં ઉત્તમ વ્યવહારોનું આદાનપ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ઈલેક્ટામા ૨૦૧૦- ઈલેક્ટામા ૨૦૧૦નું વિધિસર લોન્ચ મુંબઈમાં ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ કરાયું હતું. આઈઈએમએ દ્વારા આયોજિત આ ભારતીય વિદ્યુત ઉદ્યોગની ઈકોસિસ્ટમનું સૌથી વિશાળ પ્રદર્શન છે, જેમાં દુનિયાની વીજ ક્ષેત્રની ઈકોસિસ્ટમનો સૌથી મોટો મેળાવડો જોવા મળશે.

વધુ વિગત માટે : રચના પાવા : ૯૮૧૧૭૩૬૩૭૪ rachna.pawa@ieema.org શાલિન સિંહ : ૮૮૬૦૨૧૮૭૫૮ shalini.singh@ieema.org

“શ્રી રંગઅબધૂત લીલામૃત”

અવધૂત લીલામૃત

પાંવ-પાદુકા નથી ધરી, અડવા ચરણે એમ, ધીમી ચાલે માર્ગ પર, ચાલી રહ્યા છે તેમ.



શ્રી રમેશ બી. ડેસાઈ

આશ્ર્ય-આવેગ મહીં, લાલજ બોલયા જાય;

ત્યાં તો નજીક વાડની, આવી ગયા ગુરુરાય. ગાંડો ઘેલો થઈ ગયો, લાલજ અતિશય આમ,

કરતો ઢેણાં પર પડી, અષઅંગથી પ્રણામ.

ક્ષાળ બે ક્ષાળ થોભ્યા પ્રભુ! ઉંચો કરીને હાથ;

ઝું ઝું ઉચ્ચારથી આખ્યા આશીર્વાદ.

લાલજભાઈનો દૂર થયો અંતર તણો વિષાદ;

તપી હૃદય થયું તૃત્પી, જ્યાં દર્શનનો વરસાદ.

ધૂળિયા માર્ગ ચાલિયા, ધીમે સદગુરુનાથ,

ધીરે ધીરે દસ્તિથી, દૂર દીનાનાથ.


વૃક્ષો પાછળ થાય જો, અદ્રશ્ય ગુરુરાય;

જાગ્યો ત્યારે લાલજ તંત્રામાંથી ત્યાંય.

આંખો ચોળી ફરી ફરી મન વિચારે વાત,

નારેશ્વરના નાથનાં, દર્શન થયાં સાક્ષાત.

લાલજ મનોમન વિચારે છે જ્યારે જ્યારે બાપજી બહાર જાય ત્યારે ત્યારે તેમની સાથે ૧૦-૧૨ જાણા તો હોય જ છે, આજે વિકટ માર્ગ પર એકલા કેમ જવા દીધા, બધા શું કરે છે? એમ વિચારી બાપજીની પાછળ દોટ મૂકે છે, નદીના તટ સુધી પહોંચ્યો પણ બાપજી ન મળ્યા, એવામાં નદી પાર સામેથી બે જાણાને આવતા જોયા લાલજ બધી વાત કરે છે ત્યારે પેલા બે જાણા કરે છે અમે મોડિયાથી આવીએ ધીમે રસ્તામાં કોઈ મળ્યું નથી. લાલજ ગામમાં જાય છે, અને પૂછે છે ભલે બાપજી એકલા જવાનું કરે પણ તમે બધાએ એકલા કેમ જવા દીધા? ગામના સેવક કરે છે લાલજ તારી ડાગાના ચસકી ગઈ છે, બાપજી કુટિરની બહાર નીકળ્યા જ નથી, વડોદરાથી આવેલા ભક્તો સાથે દસી દસી વાત કરે છે. ત્યારે લાલજ વિચારે છે મેં દર્શન કર્યા તેનું શું? લાલજ પીંપળાના ઝાડ નીચે બાપજીને ભક્તોની સાથે જુઓ છે. લાલજએ વાડ આગળ જે વેષમાં બાપજીના દર્શન કર્યા હતા. તે જવેષમાં અંદ્રી પણ જોયા તેની તો જ્ઞાન જ સીવાઈ ગઈ, ગામમાં આવી બધાને ફરીથી માંડીને વાત કરે છે, આ સાંભળીને સૌ ભક્તો આનંદવિભોર બની ગયા અને આબા ગામમાં વાત પ્રસરી કે અવધૂતજીએ બે સ્વરૂપ ધારણ કર્યા. રાત્રે બાપજી કુટિરની માંદ્ય સૂતા હતા. ત્યારે ભક્તને કરે છે મારા ચરણ દુઃખે છે, આ સેવક લાલજની વાત બાપજીને કરે છે, ત્યારે બાપજી કરે છે:-



શ્રી રંગઅબધૂતજી

સાંભળ આખા વિશ્વમાં, ચમત્કાર કરનાર,
કઈ વસ્તુ છે ઓહનો, કર તું જરા વિચાર.
ભાવસભર શબ્દા અને તીવ્ર ઈચ્છા હોય,
તેને માટે વિશ્વમાં, કશું અશક્ય ન ક્યાંય? (ક્રમશ:)

- રમેશ ડેસાઈ

ટેક્કન હેલ્પકેર લિમિટેડ

તાજેતરમાં તેના ૧ સેન્ટ સાથે યાદી

થયેલ છે જીએસેઈ પર આઈપીઓ દાલમાં રૂ. ૧૦૦ ના ઈયુના ભાવની સરખામણીએ ૧૨૫.૫૦ કંપની દ્વારા પ્રમાણ કરવામાં આવે છે. મિન્ટો પુરુષોત્તમ ગુપ્તા, એમ.એસ.બી. બાયોકેમિસ્ટ્રીમાં ન્યુસ્ટ્રોસ્યુટીક્લબ ઉત્પાદનોના સંશોધન અને વિકાસમાં ૨૦ વર્ષથી વધુનો અનુભવ છે.

તેમના નેતૃત્વ દેંણ ટેક્કન હેલ્પકેર એક ઝડપથી વિકાસ પામતા હું એ ન્યુસ્ટ્રોસ્યુટીક્લબ અને ખોરાક પૂર્ક વ્યવસાય છે. ટેક્કન અત્યારે ૭૦ ઉત્પાદનો અન્ય ફોર્મ્યુલેશન્સના આધારે કંપની દ્વારા તેના ઓનલાઈન અને ખોરાક પૂર્ક વ્યવસાય છે. ટેક્કન અને કંપનીના ઉપયોગ કરવામાં આવે રોગોને દખલ કર્યા છે. જે સૂક્ષ્મ છે. તેમાં ન્યુસ્ટ્રોસ્યુટીક્લબ અને કેરમ

પોખકતત્ત્વોના આરડીએને મળીને સારા પોષણ દ્વારા અટકાવી શકાય છે. કંપનીનું યુએસપી ખેતમાંથી સીધા જ ઘટકોની પ્રાપ્તિ છે. પોતાના આર એન્ડ ડી પર આધારીત, નવીન ive ટી ટકનીકીનો ઉપયોગ કરીને કંપની કૂડ અને ન્યુસ્ટ્રોસ્યુટીક્લબ માટેના મોટા આસપાસ મારફતે વેચવામાં ફોર્મ્યુલેશન્સ વિકસાવે છે.

અત્યારે ૭૦ ઉત્પાદનો અન્ય ફોર્મ્યુલેશન્સના આધારે કંપની દ્વારા તેના ઓનલાઈન અને ખોરાક પૂર્ક વ્યવસાય છે. ટેક્કન નેટવર્ક દ્વારા માર્કેટિંગ અને વિતરણ હેલ્પકેર ધર્ણી બધી વિકૃતિઓ અને નેટવર્ક દ્વારા માર્કેટિંગ કરવામાં આવે રોગોને દખલ કર્યા છે. જે સૂક્ષ્મ છે. તેમાં ન્યુસ્ટ્રોસ્યુટીક્લબ અને કેરમ

(પેજ નં. ૪ થી ચાલુ)

સ્વતંત્રતા બીજાં પાસેની પૂનમ શાહનું અભિવાદન કરી. અપેક્ષાથી, સ્વતંત્રતા પોતાની નભળાઈ અને ડરથી!! સ્વયં શિસ્તથી વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓને નાથી અનો સ્વામી બને છે, નહીં કે ગુલામ!

આમ એક સુંદર વ્યાખ્યાનનો અંત આવ્યો ત્યારે પ્રેક્ષકોએ ઘડિયાળને સરખાવ્યાં, ખરેખર એક કલાક થઈ ગયો? પૂનમ શાહને વિવિધ પ્રશ્નો પૂછી તેમણે સંતોષમાં

- સંકલન : માયા દેસાઈ

જોતો... ખરો...!

જો તો ખરો લોકો આપગુને પાગલ કરે
ને દાથના ચાળા કરતા એ મોબાઈલ કાને ધરે
દુથના ઈશારાઓ કરી એ વાતો કરે છે.
ને આપગુને પાગલ ખાને ઘેલવાનું બાનું ધરે
એવા છે આપગણાથી ચાર ચાસણી ચઢે,
છતાં એ લોક આ શહેરમાં ધૂટા ફરે
નગાડી કે ટ્રેનમાં બેસે એ સખાગુણ
દેન્ડ ફી મોબાઈલ પર એ ઝડપ કરે.
વાતો કરતા દાથ આડા અવળા કરે
બાજુમાં ઉમેલના ગાલ પર ઉંચા દાથની ધરે
ઉઠે મારવા જ્યાં ઊભેલ બાજુ વાગો
તો સોરી-સોરી માફ કરો કહીં કરગરે.
નેતા પાગલ ભાષણ દેતા એના ખીસ્સા ભરે
“અધીર” અભણું નેતા આજ કેવા વટથી ફરે
જાણો ન તો યે મોબાઈલ મૌંધા ગજવે ધરે
ને એકલા એકલા વાર્તા લોકને દેખાવા કરે.
- અમૃત સી પંચોલી “અધીર”

ટેક્કન હેલ્પકેર લિ.

ટેબ્લેટ્સ, હાઈ કેપ્સ્યુલ્સ, સોફ્ટ જ્લ કેપ્સ્યુલ, ઓલિમેન્ટ્સ, લિક્વિલ્સ, પેસ્ટ્ર્સ, પાઉર્સ, કીમ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ હેતુઓ જેમકે હેર કેર, ચામડી કેર, હદ્દ્ય સંભાળ, અન્ય રોગનિવારણમાં રોગપ્રતિકારક ઇમારત.

મજબૂત નાણાડીય કામગીરી: કંપની માટે મજબૂત વેચાણ અને નફામાં વ્યવસાયની સફળતા પ્રતિબિંબિત થાય છે. FY19 માં કંપનીએ રૂ. ૫૫ કરોડ ઉપરાંતના લોકો % ૩૫ યુધ દ્વારા તેનું વેચાણ વધવા માટે અંદાજ છે. FY18 દખખાળના ઇપિયાનું ટર્નઓવર નોંધાયું હતું હતી. ૪૦ કરોડ ઈબીઆઈટીઓ રૂ. ૧૫ કરોડ યોય અને PAT ૧૩ કરોડ. આઈપીઓ બંડોળના ભાગનો ઉપયોગ દેવાની ચુકવણી માટે દ્રવામાં આવતો હતો. હવે મજબૂત બેલેન્સ શીટ અને દેવા મુક્ત દીવાથી, ટેક્કન તેના નવા પ્રોજેક્ટ ઓફિસિંગને આગળ વધારવાની આવેલ્દનદાઉસ છે જેમાં પોજના ધરાવે છે.

GOVERNMENT OF MAHARASHTRA

PUBLIC WORKS DEPARTMENT

PRESIDENCY DIVISION, MUMBAI

E-mail : presidency.ee@mahapwd.com

E-TENDER NOTICE NO. 128 FOR 2018-2019

Online E-Tenders in B-1 Form for the Following Work are invited by the Executive Engineer, Presidency Division, PWD, 2nd floor Bandhakam Bhavan, 25 Murzban Road, Fort, Mumbai - 400 001 (Tel. No. 22016975/22016977) from contractors registered in appropriate class of the Public Works Department, Right to reject/accept of all or one tender is reserved by the undersigned.

Sr. No.	Name of Work	Amount Rs. Lacs
1	Providing Paver Block at Rear gate of Building and back side of Tower Bldg and Near AC canteen portion at New Council Hall Bldg at Mumbai.	36.39.653/-

Issue Date : 29.1.2019 to 7.2.2019

Opening Date : 8.2.2019

All the corrigendum / Changes pertain to notice will not published in newspapers, that will published in E-tendering process.

All the detail information is available on following websites

1) www.mahapwd.com

2) www.mahatenders.gov.in

No. PD / TC / 1147

Office of the Executive Engineer,

Presidency Division, P.W.D., 2nd floor,

Bandhakam Bhavan, 25, Murzban Road,

Presidency Division, Mumbai.

Fort, Mumbai 400 001

Date : 241-2019

(Sanjay D. Indurkar)

Executive Engineer

Presidency Division Mumbai.

શિસ્ત શબ્દ સંભળતા આવ્યો
ત્યારથી એક ચોક્કસ પ્રકારનું વર્તન
અને તેની સાથે જોડાયેલ શિક્ષા કે
દંડ... બસ આજ કદમ્પના છે
શિસ્તની! પણ શિસ્ત એટલે સતત
શીખવું, શિખવવું અને અપનાવવું
- આજ શિસ્તને સ્વયં સાથે જોઈએ
ત્યારે સફળતા સમાનુભૂતિ પ્રેમાળ
સંબંધો અને શ્રદ્ધા સાથે જોડાઈ
જાય છે. સમાનુભૂતિ એટલે
સામેના પક્ષની વથા સમજવી, જે
માટે એ વથા અનુભવવી જરૂરી
નથી પણ એની પરિસ્થિતિ કે
સંજોગોને સમજવું, આ સ્વયં એટલે
શું?

સ્વયંને ગ્રતીત : ૧) જે ખુદને
ખબર છે અને બીજાને પણ છે. ૨)
જે ખુદને ખબર છે પણ બીજાં
જાણતાં નથી.

સ્વયંને અપ્રતીત : ૧) જે
બાજુ ફક્ત બીજાને ખબર છે,
ખુદને નહીં. ૨) જે વિશે ખુદને કે
બીજાને ખબર નથી.

આમ ખુદને વિશે જુદાં જુદાં
દિશિકોણથી સમજવાથી પોતાની
કિમત વિશે જાણી શકાય છે. સ્વયંને
શિસ્તમાં રાખવું એટલે એક સતત
પ્રક્રિયા, પ્રેક્ટીસ અને પ્રભુત્વ.
વિદ્યાર્થી તરીકે નિયમિત અભ્યાસ,
યોગ્ય આદાર અને રમતગમત એ
શિસ્ત હોય - જ્યારે એક
ગૃહિણીના માટે આખા ઘરને
સુગમતાથી ચલાવવું એ શિસ્ત હોય.

શિસ્ત એ એવી પ્રક્રિયા છે જે
શીખતી વખતે આપણે અનુભવી
શકતાં નથી કે એનો આનંદ ઊઠાવી
શકતાં નથી પણ શિસ્તબદ્ધ થયા
બાદ શાંતિમય જીવનને અનુભવી
શકીએ છીએ.

આમ સ્વયંની
શિસ્ત, મજબૂત
મનોબળ કે સંયમ
એ સમાનાર્થી
શબ્દો જ છે.
માનસિક જ્ઞાતિ
સાથે જે કાર્ય પૂર્ણ
કરીએ, મન ન
માનતું હોવા

છતાંયે, એટલે જ શિસ્તબદ્ધ
સ્વયં!! આવી સુંદર સમજ સાથે
પૂર્ણમ થાએ “શિસ્ત એટલે શિક્ષા
નહીં, દંડ નહીં પણ સ્વયંને જીવતાં
શિખવવું...” રહ્યું ત્યારે પ્રેક્શનકગણ
જાણે શાળાનાં વર્ગમાં અદલ વાળી
મોં પર આંગળી રાખી બેઢું હતું. તા.
ફંઝી જાન્યુઆરી ૨૦૧૮ની ઠંડી
સાંજે આસ્થા-રે ઓફ હોપ ટ્રસ્ટના
ઉપકરે પોજાયેલાં સ્વયંશિસ્તના
વ્યાખ્યાનમાં સાઈકોલોજીસ્ટ પૂર્ણમ
થાએ વિસ્તૃત માહિતી આપી.

તેમણે જાણાવ્યું કે કોઈ
શિસ્તની આદાત પાડતી વખતે
એનો આનંદ માણી શકતો નથી
પણ એ આદાત કેળવવાથી જીવન

ખૂબ શાંતિમય બને છે.
શીખતી વખતે આપણે અનુભવી
શકતાં નથી કે એનો આનંદ ઊઠાવી
શકતાં નથી પણ શિસ્તબદ્ધ થયા
બાદ શાંતિમય જીવનને અનુભવી
શકીએ છીએ.

અપેક્ષા રાજે અને વધુ સ્વીકારે

“સ્વયં જ વ્યક્તિનો મિત્ર છે અને
સ્વયં જ એનો શરૂં!” તેથી સ્વયંને
સાથે રસ્તે દોરવંસુ જરૂરી છે. મનુષ્યની
વાણી, વર્તન અને બીજાના વિશે

આ વિશે એક નાની વાર્તા કહેતાં

જાણાવ્યું કે એક
સાધુ જેની પાસે
એક નાના વાટકા
સિવાય કશું જ
નદોતું એ એક
દિવસ નાદીકિનારે
આવ્યા. ત્યાં એક
કૂતરાને નાદીમાંથી
પાણી પીતાં

જોયા બાદ પોતાના પર શરમ
ઉપજી. તેના વિશેની આસક્તિ
બદલ પરસ્તાવો થયો અને તેમણે
વાટકો ત્યજ દીધો. બે દાથની
મદદથી પાણી પીધું અને તેમણે
જ્ઞાન મેળવ્યું કે આ દાથમાં સમાય
એટલું જ ખાવાનો કુદરતી નિર્દેશ
હોય છે. જૈન ધર્મના ઉપવાસમાં
ખાવાનું તો તકન નિષેધ પણ પાણી
સુદ્ધાં એક નિયત સમયગાળામાં જ
લેવાનું હોય છે. આવી આકરી તીમ
મનુષ્યને સંયમિત અને સ્વતંત્ર
જ્ઞાત કરી દે છે જેના લીધે મનોબળ
વધે છે, નિર્ધિષ્ટકિ વધે છે.

અપેક્ષાર્થી મન દુઃખ તાય છે
તેથી મનને એ રીતે કેળવવું કે ઓછી

જગતની દરેક વસ્તુ આપણને
કશું જ શિખવતી હોય છે. બાળકો
પાસેથી નિર્દોષતા, કૂતરા પાસે
વફાદારી કે કરોળિયા પાસે અઢળક
ધીરજ... કોઈપણ વસ્તુ જે
આપણને જિન્ન કરે છે, તે ધીરજ
રાખતાં શીખવે છે. જો વસ્તુ
ત્યાગી શકીએ તો સ્વતંત્રતા
ભોગવી શકીએ. જે વ્યક્તિ અથવા
પ્રસંગથી ગુર્સો આવતો હોય તે
ક્ષમા આપતાં શીખવે છે. જે
આપણાથી વધુ શક્તિશાળી છે એ
જી ફરી શક્તિ મેળવવા પ્રેરિત કરે
છે. જ્યારે નફરત ઉદ્ભાવે ત્યારે જ
બિનશરતી પ્રેમ થાય છે. કોઈ વસ્તુ
વિશેનો ડર જ હિંમત કેળવતાં
શીખવે છે. જ્યારે પરિસ્થિતિ
નિયંત્રણની બહાર જાય ત્યારે
સુધીની આપણાને એને છોડી

શીખવે છે. આમ સ્વયંને શિસ્ત
શિખવવા વિવિધ દિશિકોણથી
પ્રયત્ન કરી શકાય. ચારિત્રયવાન
વ્યક્તિ માટે સ્વયંશિસ્ત એનું સર્વેદ્વ
હોય છે. એ પોતાની દરેક કિયા-
પ્રક્રિયામાં સ્વયં શિસ્ત પાળે છે જે
આજીવન એની આદત બની જાય છે.

આ સ્વયં શિસ્તના ફાયદા
અઢળક છે, જેમાંથી મુખ્ય છે: ૧)

મૂને નિયંત્રિત કરી શકાય છે -
ખૂબ ખુશી કે ખૂબ દુઃખી સંવેદન
તંત્ર હલી ન જાય. દરેક પરિસ્થિતીને
અપનાવવાની આદત કેળવાય છે.
૨) યોગ્ય શબ્દ વાપરવાની ટેવ પેડ
છે - ખોટા શબ્દો દ્વારા નિર્માણ
થતી ગેરસમજ ટાળી શકાય છે. ૩)

પ્રતિક્રિયા પર નિયંત્રણ મેળવાય છા
- કોઈના દ્વારા કરાયેલ ટીકા, ધૂણ
કે નિંદા માટે તરત પ્રતિક્રિયા ન
આપતાં વિચાર કરવાની ટેવ પેડ છે.

૪) નિયમિત દિનચર્યાની ટેવ પેડ
છે - એક સુવ્યવસ્થિત જીવન
જીવવાનો કમ ઘડાય છે જેનાથી
પોતાને તેમજ સાથે રહેનારાઓને
સુખ મળે છે. ૫) પૈસાનું યોગ્ય
નિયોજન - સ્વયં શિસ્ત કેળવેલ
વ્યક્તિ પોતાના આર્થિક વ્યવહારો
વિશે ખૂબ વ્યવસ્થિત હોય છે. ૬)

સારી તંદુરસ્તી ભોગવે છે - સ્વયં
શિસ્તના લીધે વિચારો નિયંત્રણમાં,
આદાર સમયસર અને માપસર
દોષાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બેંકદરે
ઉત્તમ રહે છે..

સ્વયં શિસ્તને અપનાવવા
દિવસના ૨૪ કલાકને વ્યવસ્થિત
વહેંચી કાઢવા જોઈએ.

૮ કલાક ઈમાનદારીથી પરિશ્રમ

૮ કલાક ઉંઘ

૮ કલાક કુંબા, સમાજ તેમજ
દેશના કલ્યાણાર્થ

પૂનમ શાદ જાણાવ્યું કે દઢ
મનોબળ, ઉચ્ચ બુદ્ધિ આંક કરતાં
વધુ જરૂરી છે. એક વ્યક્તિ વધુ
ચાલાક ન હોય પણ સ્વયંશિસ્તને
વરેલી હોય તો તે આગવું સ્થાન
મેળવી શકે છે. સ્વયંશિસ્ત એ કોઈ
બંધન નથી પણ સ્વયંશિસ્તા છે.
સ્વતંત્રતા આપણાને એને છોડી
(અનુસંધા